

બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૧/૦૧/૨૦૨૦ થી તા.૧૭/૦૧/૨૦૨૧ સુધી)

(૧)

તા.૧૩/૦૧/૨૦૨૧ ના કલાક ૧૮/૩૦ વાગે મોજે નેનાવા ચેકપોસ્ટ આ કામના તહેદાર ઓમપ્રકાશ સ/ઓ રામારામજી જાલારામજી જાતે. ગોડ (બ્રામણ) રહે.રામદેરીયા (કાશ્મીર) તા.શીવ જી.બાડમેર (રાજસ્થાન) તથા દેવેન્દ્રકુમાર સ/ઓ ભેરારામ વક્તારામ જાતે. જાટ (ચૌધરી) રહે.માડપરા તા.બાયતુ જી.બાડમેર (રાજસ્થાન) તથા હેમરાજ સ/ઓ રેખારામ દેરાજરામ જાતે. જાટ (ચૌધરી) રહે.સાજટા તા.બાડમેર જી.બાડમેર (રાજસ્થાન) વાળાઓ રાજસ્થાન સરકારી બસમાં બેસી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની છુટી બોટલો નંગ-૨૯ મળી કુલ કિ.રૂ.૨૭૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૬૦૦૦/- આમ કુલ મુદામાલ કિ.રૂ.૩૬૭૮૦/- નો મુદામાલ સાથે પકડાઇ જઇ તથા પ્રોહી મુદામાલ આપનાર ઓમપ્રકાશ રહે.મોખાબ તા.શીવ જી.બાડમેર વાળાઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોઇ તેઓના વિરૂધ્ધ ધાનેરા પો.સ્ટે.પાઈ.સી.ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૮૨૧૦૦૪૩/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ,૧૧૬ (૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

તા.૧૪/૧/૨૦૨૧ના કલાક ૦૭/૪૫ વાગે મોજે ખોડા પોલીસ ચેક પોસ્ટ ગામે આ કામના ટ્રક નં.GJ.12.AT.6875ના ચાલક . ભલારામ અમરામ જસારામ જાતે.જાટ(ધત્તરવાલ) રહે.ખારીયાકિત્તા તા.રામસર જી.બાડમેર રાજસ્થાન વાળાને હીરસિંગ ચંદનસિંહ રાજપુત રહે.કલ્યાણપુર ચૌહટન બાડમેર મો.નં.૭૨૯૭૯૮૯૫૬,૭૦૭૩૭૮૧૭૮૯ વાળાએ બાડમેરથી સાંચોર રોડ ઉપર એચ.પી પેટ્રોલ પંપ પાસેથી ટ્રકમાં ગે.કા અને વગર પાસપરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ કંપનીની પેટીઓ નંગ-૭૫ જેની કુલ બોટલ નંગ-૩૬૦૦ તથા છુટી બોટલ નંગ-૩૫૧ એમ કુલ બોટલ નંગ-૩૯૫૧ જેની કુલ કિ.રૂ.૪,૧૨,૦૪૮/-નો દારૂ તથા ટ્રકની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦/- તથા ગાડીના સાધનીક કાગળો તથા રસ્સી કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રકમ રૂ.૨૨૦૦/- એમ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૪૧૪૭૪૮/-ના મુદામાલ સાથે એકબીજાના મેળા પીપણાથી ભરી ભરાવી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં ઘુસાડી હેરાફરી કરતા તહે નં.૧ પકડાઇ જઇ ગુનો કરેલ હોઇ તેઓના વિરૂધ્ધમાં થરાદ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૧૦૦૪૯ પ્રોહી એક્ટ કલમ.૬૫.એઇ,૧૧૬(૨),૯૮(૨), ૯૯, ૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

તા.૧૫/૦૧/૨૦૨૧ના ક.૧૨/૩૦ વાગે મોજે જેતડા સીમમાં આ કામના આરોપીઓ (૧) તારાભાઈ હરજીભાઈ લુહાર રહે.જેતડા તા.થરાદ મૂળ રહે.બાખાસર તા.ચૌહટન જિ.બાડમેર(રાજસ્થાન) તથા (૨) દાતારસિંહ ઉમેદસિંહ દરબાર(રાઠોડ) રહે.જેતડા સીમ તા.થરાદ (૩) સુમેરસિંહ ઉમેદસિંહ દરબાર(રાઠોડ) રહે.જેતડા સીમ તા.થરાદવાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરની આગળ ખુલ્લી જગ્યામાં બોરની ટાંકી પાસે, તબેલા પાસે તેમજ ખેતરમાં રાયડાના વાવેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો દેશી દારૂ ગાળવાનો વોશ લીટર- ૪૨૦૦ લીટર વોશ કિંમત રૂ.૧૬,૮૦૦/- નો રાખી આરોપી નં.૧ હાજર મળી આવી તથા આરોપી નં.૨ તથા ૩ ઘરે હાજર ના મળી આવી ગુનો કરેલ હોઇ તેઓના વિરૂધ્ધ થરાદ પો.સ્ટે.પાઈ-સી.ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૧૦૦૫૫ પ્રોહી એક્ટ ક.૬૫(એફ), ૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

તા.૧૭/૦૧/૨૦૨૧ ના કલાક ૪/૪૦ વાગે મોજે નારોલી ગામે આ કામે બોલેરો ગાડી નંબર RJ-21-UB-4668ના ચાલક અનિલકુમાર સ/ઓ હેતરામ સહિરામ જાતે.સિધુ(જાટ) રહે. ૧૦.૫૦૦ ડી.ઓ.ડી.ડી. ચક કી ઢાણીયા, તા.પુગલ જિ.બીકાનેર રાજસ્થાનવાળાએ પોતાની કબજાની ગાડીમાં ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૨ બોટલો નંગ-૧૫૩૬ કુલ કિ.રૂ.૧૫૩૬૦૦/-નો તથા બોલેરો ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા અસલ આધારકાર્ડ અને અસલ આરસીબુક કિ.રૂ.૦૦/- તથા રોકડ રકમ રૂ.૨૫૦/-નો એમ મળી કુલ મુદામાલ કિ.રૂ.૫,૫૮,૮૫૦/-નો મુદામાલ ભરી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં ઘુસાડી હેરાફરી કરતા પકડાઇ જઇ તથા સુધીર ગોદારા મો.નં.૯૭૭૨૦૯૨૩૯૨ વાળાએ દારૂ ભરાવી કલાભાઇ વિહાભાઇ રાજપુત રહે.ઢીમા તા.વાવ મો.નં.૭૨૬૬૬૧૭૮૭ વાળાએ પકડાયેલ દારૂ મંગાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોઇ તેઓના વિરૂધ્ધમાં થરાદ પો.સ્ટે.પાઈ-સી.ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૧૦૦૬૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૯૮(૨), ૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

તા.૧૭/૦૧/૨૦૨૧ ના કલાક ૦૦/૫૦ વાગે મોજે પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલ સ્વાગતસીટી સોસાયટીની બાજુમાં આવેલ ન્યુ બાલાજી ગેરેજ ની પાછળ ખુલ્લી જગ્યામાં કે આ કામના તહેદારોએ મોજે પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલ સ્વાગતસીટી સોસાયટીની બાજુમાં આવેલ ન્યુ બાલાજી ગેરેજ ની પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમા ત્રણતીનો ગંજીપાનાનો હાર-જીતનો જુગાર રમી-રમાડી રોકડ રકમ રૂપીયા ૧૨,૧૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ જેની કુલ કિ.રૂ.૧૦૦૦/- તથા ગંજી પાના પર કિ.રૂ.૦૦/૦૦ સાથે પકડાય જઇ ગુનો કરેલ હોઇ તેઓના વિરૂધ્ધ પાલનપુર સીટી પશ્ચિમ પો.સ્ટે.પાઈ-બી ગુ.ર.નં.11195010210040/૨૧ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.